

यामहंड

सुश्री भगद

Preface

Shri Swaminarayan Bhagwan, just after ordaining Shri Nishkulanand Swami, asked him to prepare "Yamdund". Swami wrote Yamadund and dedicated it to Shriji Maharaj. Shri Hari was extremely pleased on seeing-going through it. He asked His saints to paint and depict how a person, on his/her misdeeds, is taken away by Yamadutas after his/her death and how does he/she suffer in Yamalok. Thus, painter-saints prepared such pictures. Saints used to move from one village to another and were explaining, showing those paintings, how one suffers after death if one misbehaves during one's life. Thus people were brought to rightful path of life.

This book (presentation) was prepared from the pictures which were originally drawn, illustrated at the behest of Lord Shri Swaminarayan. It is requested that this book be taken house-to-house, village-to-village, place-to-place and be shown to one and all so that people may inspire to own one copy of their own. Thus, the efforts of Shri Nishkulanand Swami and other saints may usefully be spread.

The translation work of this Yamadund in English has been done by Prof. (Dr.) B. P. Swadas. May Lord Swaminarayan shower His blessings upon Him.

I dedicate this "Yamadund" book to Shri Harikrishna Maharaj of Vadatal. May Shri Harikrishna Maharaj's blessings shower on all those who have helped in preparation of this book.


Jay Shri Swaminarayan

Kanji Bhagat



Lord Shri Swaminarayan ordains Swami Nishkulananda to write an illustrated book 'Yamadund' (describing the tortures inflicted up on the sinner by Yamadutas) so that people might stop doing sinful acts.

શ્રી સ્વામિનારાયણ ભગવાન નિષ્કુલાનંદ સ્વામી પાસે યમદંડ ગ્રંથ લખાવે છે અને તેનાં ચિત્રો કરાવે છે, જેથી અનેક જીવ પાપમય કર્મ કરતાં અટકે અને ભગવાનના દ્રઢ આશ્રિત થઈને અક્ષરધામને પામે.



World is like a tree, and the Jiva (soul) is hunting after five types of sensual pleasures which are like drops of honey on that tree. Days and nights are like mice boring holes through that tree. Down below which is located a hell-like death-well. Those who are followers of Lord Shri Swaminarayan abiding five vows given by Him have the privilege of being taken to His Abode by Himself.

સંસારરુપી વૃક્ષ છે તેના પર બાહેલા મધમાંથી પંચવિષય રૂપી ટીપાંને જીવ ગ્રહણ કરે છે. દિવસ અને રાતરૂપી ઉદરડા તે વૃક્ષને કોચી ખાય છે. નીચે કાળરૂપી કૂવો છે જે નરક સમાન છે. જે શ્રીજી મહારાજનાં પંચવ્રતમાન ધારણ કરી હરિભક્ત થાય છે તેને ભગવાન પોતે તેડવા આવે છે.




After Jiva leaves his body, Yamadutas produce him before Dharma-rajā, who listens from Chitragupta the account of good or bad deeds of jiva recorded by Chitragupta, Vichitra and Chitrālekha. Then, Dharma-rajā sentences him proper punishment and consigns to Yamadutas.

પાપી જીવને મર્યા પછી ધર્મરાજાના દરબારમાં હાજર કરે છે. ચિત્રગુપ્ત, વિચીત્ર અને ચિત્રલેખાએ તેનાં પાપ-પૂણ્યની નોંધ કરી રાખી હોય છે. તેને ચિત્રગુપ્ત ધર્મરાજાની સમક્ષ કહી સંભળાવે છે. ધર્મરાજા તેનો ન્યાય કરી યોગ્ય સજા કરી યમદૂતોને હવાલે કરે છે.



When Yamadutas thrash a Jiva-disinclined to God, he is horrified seeing the frightful appearance of Yamadutas and loudly cries out. Yamdutas separate him from his body and bring to Yampuri.

યમદૂતો પ્રભુથી વિમુખ જીવને જોર કરીને મારે છે ત્યારે જીવ દુઃખથી પોકાર કરે છે અને યમનો ભયંકર વેશ જોઈને જીવ કંપી જાય છે. યમ તેના દેહમાંથી જીવને છુટો પાડી યમપૂરીમાં લઈ જાય છે.



Kumbhipaka Hell: Those who are cruel and hot tempered and cook other living beings for their food are kept in Kumbhipaka Hell. Here, they are cooked in boiling oil and eaten by Yamdutas.

તીખા, ઉગ્ર અને નિર્દય સ્વભાવવાળા જે જીવ, જીવતાં પશુપક્ષી વગેરેને રાંધીને ખાય છે તેને યમદૂતો કુંભિપાક નરકના કુંડમાં ગરમ ઉકળતા તેલમાં પકાવીને ખાય છે.



Maharaurava Hell: He who supports his own body only is thrown into Maharaurava Hell wherein he is stung by serpents, scorpions, centipedes and crows. Besides, Yamdutas beat him with hammers, hatchets, spears and hammers.

કેવળ પોતાના જ દેહનું પોષણ કરનાર સ્વાર્થી જીવને મહારૌરવ નરકમાં નાખવામાં આવે છે. અહીં તેને સાપ, વીછી, કાનખજૂરા કરડી ખાય છે, કાગડો ચાંચ મારે છે. યમદૂતો તેને મુદૂગલ, ફરસી, ભાલા અને હથોડાથી મારે છે.



Raurava Hell: He who troubles others for the selfish sake of his family is hung with his head downward in Raurava Hell wherein he gets severe pains and weeps.

પોતાનું તથા પોતાનાં કુટુંબીજનોનું પોષણ કરવા જે જીવ બીજાનો દ્રોહ કરે છે તે જીવને યમદૂતો રૌરવ નરકમાં ઊધે માથે નાખે છે અને તેને પીડે છે તેથી તે ખૂબ રુદન કરે છે.



Kalsutra Hell: He who makes mischief to Brahmin, Vedas, Guru or to his father is condemned to Kalsutra Hell wherein he is subjected to horrible fire flames from beneath in addition to the scorching heat of twelve suns overhead. He is retained under such punishment for as many thousand years as the number of hairs on his body.

બ્રાહ્મણ, વેદ, ગુરુ અને પિતાનો દ્રોહ કરનારા જીવને યમદૂતો કાળસૂત્ર નરકમાં નાખે છે. માથા ઉપર બારે સૂર્યો તપતા હોય છે અને નીચે અગ્નિની જ્વાળાઓમાં જીવને શરીરે જેટલાં રોમ છે તેટલાં હજાર વર્ષ બળવું પડે છે.



Krumibhojan Hell: Who dines alone without caring for others or without performing five Mahayajnas is dropped into Krumibhojan Hell, the meanest of all hells, wherein worms sting him and he is greatly annoyed as he is given worms to eat here.

પંચ મહાયજ્ઞ કર્યા સિવાય તેમજ જે કાંઈ મલ્યું હોય તે બીજાને વહેચ્યા વિના જે એકલો જ જમે છે તેને સૌથી અધમ એવા કૃમિભોજન નરકકુંડમાં નાખવામાં આવે છે. અહીં કૃમિ તેને ચટકા ભરે છે. અહીં તેને ખાવામાં કૃમિ અપાય છે. તે ખૂબ ત્રાસ આપે છે.



Sandashan Hell: One who steals, knowingly or unknowingly, the gold and jewels of Brahmins or of other is drawn to Sandashan Hell. Here, one's skin is peeled off with red-hot pincers of iron.

ભૂલમાં કે જાણી જોઈને બ્રાહ્મણ અને બીજાઓનું સુવર્ણ કે રત્નો જે ચોરે છે તેને યમદૂતો સંદશન નામના નરકમાં અગ્નિથી તપાવેલી સાણસીથી પકડીને નાખે છે. અહીં તેની ચામડી ચીરવામાં આવે છે.



Asipatravan Hell: One who, even under favorable circumstance, deflects from righteous path shown by Vedas and one who adopts heretic path are thrown into Asipatravan Hell wherein they get severely pained with sharp edged leaves of trees found in this hell.

આપત્કાળ વિના વેદમાર્ગનો ત્યાગ કરનાર તેમજ પાખંડ ધર્મનું આચરણ કરનાર જીવને યમદૂતો આશીપત્રવન નરકમાં નાખે છે. આ નરકનાં વૃક્ષોનાં પાંદડા તલવાર જેવાં તીક્ષ્ણ હોય છે. જીવ તેમાં ખૂબ દુઃખ પામે છે.




Andhkupa Hell: One who kills fleas, bugs, lice, nits, mosquito, ants, flies, beasts, birds or serpents etc. is condemned to Andhkupa Hell wherein the same insects husk away one's body and one suffers like a dog maddened with intense skin disease.

યાંચડ, માંકડ, જૂ, જિંગોડા, મચ્છર, કીડી, માખી તથા પશુ, પક્ષી, સર્પો વગેરે જીવોને મારનાર જીવને અંધકૂપ નરકમાં નાખે છે. અહીં તેને તે જંતુ ફોલી ખાય છે, કીડા પડેલા રઘવાયા કૂતરાની જેમ આ જીવની ગતિ થાય છે.



One, who cruelly injures others with arrows and poniards, has to undergo severe pains of stabbing by Yamadutas with arrows, spears and poniards.

જેણે બાણ અને કટારીથી અનેક જીવોને નિર્દયપણે માર્યા હોય તેમને મર્યા પછી યમદૂતો બાણ, ભાલા તથા કટારીથી ચીરી બહુ દુઃખ આપે છે.



One, who robs others of their wealth knocking on their heads, is tied with noose by Yamadutas and is given heavy blows on one's head.

લોકોનાં માથા ફોડી જે જીવ તેમનું ધન લૂંટી લે છે તેને યમદૂતો પાશ નાખી ખેંચી લાવે છે અને તેમનાં માથાં ફોડીને બહુ દુઃખ આપે છે.



If kings or such persons who, even being born in a noble family, transgress righteous path are thrown into the river Vaitarani which flows full of excrement, urine, blood, pus, nails, hair, bones, fat, etc. and alligators, fishes, tortoises and serpents rush to devour such jivas.

રાજા અને તેના કુળમાં જન્મેલા માણસો સારા કુળમાં જન્મ્યા હોવા છતાં ધર્મમર્યાદા તોડે છે તેમને વૈતરણી નદીમાં નાખવામાં આવે છે. અહીં વિષ્ટા, મૂત્ર, રુધીર, પરુ, નખ, કેશ, હાડકાં, મેદ પડયાં હોય છે. મગર, કાચબા અને સર્પો તે જીવને ખાવા દોડે છે.




Puyod Hell: He who neglects natural laws and fear of public opinion and commits sodomy is thrown into Puyod Hell which abounds pus, salvice, snivel, urine and excrement and he is forced to eat these. Besides, serpents, fishes, alligators, vultures, etc. prick his body.

લોકલાજ અને મર્યાદા ત્યાગીને પુરુષવૃત્તિનો સંગ કરનાર જીવને પૂયોદ નરકમાં નાખવામાં આવે છે. આમાં પરુ, લાળ, લીટ, મૂત્ર અને વિષ્ટા ભરેલાં હોય છે. તે તેને ખાવા પડે છે. વળી સાપ, નાછલાં, મગર, ગીધ, ઈત્યાદિક તેને કરડે છે.



Pranrodh Hell: He who being born as a Brahmin, Kshatriya or Vaishya kills deer, duck, etc. or he who hunts during Shraddh Parva is taken to Pranrodh Hell where Yamadutas piece his body with arrows thereby causing unbearable pain to him.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય થઈને જે જીવ હરણાં, મૃગલાં, બતક વગેરેનો સંગાર કરે છે, વળી શ્રાધ્ધપર્વમાં મૃગયા ખેલે છે, તેને યમદૂતો પ્રાણરોધ નરકમાં બાણથી વીધી તેનાં અંગમાં ચારણી જેવાં છિદ્રો પાડી બહુ દુઃખ આપે છે.



Vishasan Hell: Those who kill animals on the name of Yajnas or who admonish Vedmantras to the non-deserving or who offer goats instead of barley into Yajnas are hanged in Vishasan Hell.

જે માણસો યજ્ઞ નિમિત્તે પશુ મારે છે તેમજ અધિકાર વિનાનાંને વેદમંત્રનો બોધ આપે છે, તથા જવ જેવા ધાન્યને બદલે અજ(બકરા) હોમે છે તેને વિશસન નરકમાં ફાંસીએ લટકાવવામાં આવે છે.



Those who under the passion of lust, copulate with women of their own family line are thrown with their head downward into the river Lalabhaksha which is of semen and they are compelled to drink semen and they are greatly afflicted by lancinating their chests.

કાનથી મોહિત થઈ ચારે વર્ણના પુરુષો (પોતાના વર્ણની) નારી સાથે સંગ કરી વીર્યપાત કરે છે, તેને વીર્યની નદી લાલાભક્ષમાં ઊંધે માથે નાખી વીર્ય પીવડાવે છે અને તેની છાતી ચીરી બહુ દુઃખ આપવામાં આવે છે.



Sarmeyadan Hell: A king or his servants who plunder or set villages ablaze or who slander or commit theft are dragged to Sarmeyadan Hell. A thief is made to sleep over thornish bed. They are rumped by crows and dogs.

ગામને લૂટનાર, બાળનાર - એવા કુર્કર્મના કરનાર રાજા અને તેના માણસો તેમજ ચોરી-ચુગલી કરનારને મર્યા પછી યમદૂતો સારમેયાદન નરકમાં કાંટા જેવી પથારીમાં નાખી ખૂબ ત્રાસ આપે છે. કાગડા, કૂતરાં તેને ચૂંથી ખાય છે.



Yamadutas tie the sinner with noose of death and beating him all the way bring him to the place where Jiva is to undergo the punishment assigned by Dharmaraja - the God of death.

અધમ જીવને કાળ રૂપી પંશથી બાંધી યમદૂતો ધર્મરાજાએ કરેલી સજા મુજબ મારતા મારતા લઈ જાય છે.



Ayahpan Hell: If a Brahmin man or woman drinks liquor or people of other classes drink Somavalli drink on the day of fast, they are condemned to Ayahpan Hell wherein they are caused to drink liquid iron on boiling state.

બ્રાહ્મણ અને બ્રાહ્મણ સ્ત્રી જો સુરાપાન કરે તેમજ બીજી જાતિના લોકો વ્રતને દિવસે સોમવલ્લીનું પીણું પીએ તેવા લોકોને અય:પાન નરકમાં યમદૂતો ગરમ ગરમ લોઢાનો રસ પાય છે.



Ksharkardam Hell: He who is egoistic and believes himself to be superior to all and does not respect austere, scholars and intellectuals is dropped into Ksharkardam Hell where he is corroded by saline substances.

પોતાનેજ સહુથી શ્રેષ્ઠ માનનાર અભિમાની - તપસ્વી, વિદ્યાવાન તેમજ બુદ્ધીવાન જનોને માન આપતા નથી તેવા જીવને યમદૂતો ક્ષારકર્દમ નરકમાં વારંવાર નાખી તેને ક્ષારથી ઓગાળી નાખે છે.



Rakshoghan Bhojan Hell: He who worships malignant god like Bhairava, etc. and offers to them living beings as sacrifice and dances before them being pleased with such performances is kept in Rakshoghan Bhojan Hell where Yamadutas suck his blood.

ભૈરવ આદિ તામસી દેવોને જે નરનારી માને છે તેનજ તે દેવોને મનુષ્ય, પશુ, પક્ષી આદિકનો ભોગ આપે છે અને તેનાથી રાજી થઈ નૃત્ય કરે છે તેને યમદૂતો રક્ષોગણ ભોજન નરકમાં નાખી તેમનું લોહી પીએ છે.



Shoolprot Hell: Those who betray and hang the innocents are raised to pike in Shoolprot Hell thereby causing extreme affliction to them.

ખોટો વિશ્વાસ આપી નિર્દોષ લોકોને ઠગી ફાંસો નાખી મારી નાખે છે તેવા પાપી જીવોને યમદૂતો શૂલપ્રોત નરકમાં શૂળીએ પરોવી ખૂબ દુઃખ આપે છે.



Avrodhak Hell: He who suffocates and kills other is taken to Avrodhak Hell wherein Yamadutas choke his mouth and lock him up in a closed room and suffocate by blowing smoke in the room through pipes.

જે મનુષ્ય બીજા જીવોને અંધારી ગુફામાં કે ખાડામાં લઈ જઈ તેનું ગળું રુધી, મારી નાખે છે તેને યમદૂતો અવરોધક નરકમાં બંધ ઓરડીમાં મોઢું બાંધી બેસાડે છે અને પછી તેમાં ભૂંગળીઓથી ધુમાડો ભરી તેને ગુંગળાવે છે.



Paryavartan Hell: A householder, who instead of welcoming, insults angrily the guest is held in Paryavartan Hell. Thifter vultures, crows, etc. pick in his eyes with their beaks and Yamadutas give him manifold tyranny.

અતિથિને જોઈને જે ગૃહસ્થ ક્રોધથી લાલ નેત્ર કરી અપમાન કરે છે અને તેને સત્કારતો નથી તેને યમદૂતો પર્યાવર્તન નરકમાં નાખે છે. અહીં ગીધ, કાગડા તેની આંખો ફોડે છે અને બીજાં બહુવિધ દુઃખ આપે છે.



Suchimukha Hell: If someone is arrogant of his wealth and does not trust others, nor does any meritorious or benevolent deeds is considered so much sinful that even the animal in Yamapuri decline to eat his flesh and hence, Yamadutas take him to Suchimukha hell where his body is stitched with big needles.

ધનના ગર્વથી પોતાને બીજાથી શ્રેષ્ઠ માને છે તેનજ કોઈનો વિશ્વાસ રાખતો નથી, પૂણ્ય કે પરમાર્થ કરતો નથી. તેથી તેને યમદૂતો સૂચીમુખ નરકમાં લઈ જઈ સીવી લે છે.



One who takes one's ownself to be proficient of all and behaves arrogantly and adorns one's body with new dresses everyday and is atheistic is subjected to such terrible punishment as shown in picture.

જે પોતાને સૌથી પ્રવિણ માને અને ઉન્મત્ત ગર્વથી વર્તે તેમજ રોજ નવા નવા વેશ કાઢે અને પ્રભુને ન માને તેને યમદૂતો આવી ભયંકર સજા કરે છે.



If king or his officials punish their subjects without going through their crime, Yamadutas hang them onto pikes and their subjects in form of crows eat up meat from their body.

રાજા અને તેના અમલદારો રૈયતના અપરાધ જોયા વિના સજા કરે છે તેને યમદૂતો શૂળીએ ચઢાવે છે. રૈયત કાગડા થઈ તેમનાં શરીરને કોચી ખાય છે.



Those humbug preceptors who hold priestly positions and mistreat people are tied together and made to sit on thorn surface of Shrub and their disciples assume body of crows and suck the preceptors' blood.

મુખથી મિથ્યા જ્ઞાન આપીને કપટી લોકો ગુરુ થઈને ગાદીએ બેસી જાય છે. તેવા પાપી જીવોને યમદૂતો ભેગા બાંધીને કાંટા અને ગોખરુંની પથારી પર બેસાડે છે. તેમના ચેલાઓ કાગડા થઈ તેમનું લોહી પીએ છે.



Those who give false testimony are tied together and kept in fire. Crows and serpents pluck meat from their bodies.

જે ખોટી સાક્ષીઓ પૂરે છે તેઓને યમદૂતો ભેગા બાંધી અગ્નિમાં નાખે છે. તેમનાં શરીર કાગડા અને સર્પો કોચી ખાય છે.



Those, who burn birds, animals or human beings putting them in thorns, are laid on a thorn bed and Yamadutas press their body with their legs causing heavy oppression to the sinners.

પશુ, પક્ષી તેમજ મનુષ્ય વગેરે જીવોને કાંટામાં નાખી બાળનાર જીવોને યમદૂતો કાંટાની પથારીમાં સુવાડી પગથી દબાવી બહુ ત્રાસ આપે છે.



Those, who kill children by striking them against something, Yamadutas bind them with noose and strike them similarly against stone and torture them.

જીવતાં બાળકોને પટકીને મારનાર જીવને યમદૂતો તેવી જ રીતે પાશથી બાંધી પથ્થર ઉપર પટકે છે અને બહુ દુઃખ આપે છે.



If a yogi enjoys worldly pleasures under the less of austerity, Yamadutas hang him with his head downward over fire and they chew away his body.

યોગી થઈ તપ કરતાં જે બહુ ભોગ ભોગવે છે તેને યમદૂતો ઊંધે માથે લટકાવી નીચે અગ્નિ રાખી બાળે છે અને તેને ચાવીને ખાઈ જાય છે.



Those who deceive people under the guise of devotion, Yamadutas pull out their tongues. He who employs dancing for supporting his life, Yamadutas pluck away meat from his legs. Jives are put to such adverse circumstances.

જે દંભી લોકો હરિકિર્તન કરી લોકોને છેતરે છે તેવાની યમદૂતો જીભ ખેચી કાઢે છે. તેમજ જે પોતાનું પેટ ભરવા નાચે છે તેના પગ તોડી ખાય છે આવી વિપરીત સ્થિતિ પાપી જીવોની થાય છે.



Those women, who cook grain, etc. without cleaning it off insects are attacked by Yamadutas with weapons and serpents, scorpions, crows bite them.

જોયા વિના જીવજંતુવાળુ અન્ન રાંધનાર સ્ત્રીઓને યમદૂતો શસ્ત્રોથી મારે છે. સાપ, વીછી, કાગડા તેને કરડી ખાય છે.



If a moneylender purchases stolen goods or does not return the deposits of others, Yamadutas bind such fraudulent banker and give him heavy blows.

શાહુકાર થઈને ચોરીનો માલ રાખે તેમજ જેની તેની થાપણો રાખે અને પાછી ન આપે તેવા વિશ્વાસઘાતી શાહુકારોને યમદૂતો બાંધીને ખૂબ માર મારે છે.



Those who charm snakes and present shows thereof and those who seduce people by sorcery are kept amongst serpents who severely agonize them with their bites.

વાદી થઈને સાપ વગેરેના ખેલ કરી તેમને સતાવે છે તેનજ મંત્રતંત્રનો જાણકારી બની લોકોને છેતરે છે તેને ચમદૂતો ચમપુરીમાં સાપ વગેરે કરડાવીને બહુ દુઃખ આપે છે.




He who kills others with spears etc. is oppressively tortured by Yamadutas who prick his body with various weapons.

ભાલા અને બરછીથી જે જીવે અનેક જીવોને માર્યા છે તેને યમદૂતો શસ્ત્રોથી વીધી નાખી બહુ દુઃખ આપે છે.



Mouth of person who takes intoxicant everyday is nibbled by Yamadutas. He, who injures beasts, birds, serpents of the town, is afflicted by the same beasts, etc. as arranged by Yamadutas.

જે રોજ કેફી પીણા પીએ છે તેનું મુખ યમદૂતો કરડી ખાય છે. વળી ગામનાં પશુ-પંખી, સર્પો વગેરેને મારનારને યમદૂતો તેમના જ દ્વારા દુઃખ અપાવે છે.



Bodies of those who develop hostility to faultless persons are sawn with saws by Yamadutas.

વાંક ગુના વિના જેની તેની સાથે વેર કર્યા કરે છે તેવા જીવોને યમદૂતો કરવત વડે યમપુરીમાં વહેરે છે.




If a farmer spends nothing of his produce on meritorious deeds or engages oxen in work but feeds them nothing or castrates their testicles or bores their nostrils, Yamadutas tie such a selfish and cruel farmer with serpents and oppress him severely.

ખેતી કરી તેની ઉપજ લઈ પૂણ્ય ન કરનાર તેનજ બળદ પાસે કામ લઈ તેમને ભૂખ્યા રાખનાર તેમજ તેમનાં વૃષણ તથા નાક છેદનાર સ્વાર્થી, ક્રૂર ખેડુત જીવોને યમદૂતો સાપથી બાંધીને બહુ દુઃખ આપે છે.



If someone steals food meant for charity, Yamadutas crush him in crushing machine.

પ્રભુના ભાગનું અન્ન ચોરનાર તેમજ જીવજંતુઓને બેદરકારીથી ગાડા નીચે તથા કોલુમાં પીલનાર જીવને યમદૂતો ઘાણીમાં પીલી કચડે છે.



One who makes unjust to one's own friend is punished by Yamadutas as shown in the picture.

ભાઈબંધ થઈ અધર્મ કરવા જતા જીવોને યમદૂતો ઉપર પ્રમાણે શિક્ષા કરે છે.



Those who take intoxicants after rubbing in a mortar, Yamadutas rub them in the same way and drink them.

ખાંડણીમાં કેફી વસ્તુ ઘૂંટીને પીનારા વ્યસની જીવોને યમદૂતો તેમને ઘૂંટીને તેમનું પાન કરે છે.



The butchers who hang goats with their heads downward to kill them are hanged in the same manner by Yamadutas keeping them into a small reservoir and beat them severely.

બકરાં વગેરે પ્રાણીઓને ઊધે માથે નાખી મારનાર ખાટકી જેવા પાપી જીવોને યમદૂતો ઊધે માથે કુંડમાં લટકાવી બહુ માર મારે છે.




Those who entertain and bait women by speaking obscene speech or by sounding cymbals assuming disguise of a dancer, are brought to Yamapuri by Yamadutas and afflicted in many ways.

એલફેલ બોલી, ઝાંઝ વગાડી નાચણિયાનો વેશ ધારી સ્ત્રીઓને રીઝવીને ફસાવે છે તેવા જીવોને યમદૂતો યમપુરીમાં બહુવિધ દુઃખ આપે છે.



Those who kill others with axe are taken to Yamapuri by Yamadutas, and are heavily tyrannized in a manner similar to that in which they killed others.

જે જીવ કુહાડાથી અનેક જીવોને મારી નાખે છે તેને યમદૂતો યમપુરીમાં તેવી જ રીતે માર મારી ખૂબ જ ત્રાસ આપે છે.



One who loves to drink often eleven types of liquor and three types of wine is caused to drink liquid lead in boiling state.

અગિયાર જાતનાં મદ્ય અને ત્રણ પ્રકારની સુરાને જે જીવ વારંવાર પીએ એ તેને મર્યા પછી ચમદૂતો ઉકળતા સીસાનો રસ પાય છે.



In Yamapuri, Yamadutas enjoy the journey by a carriage pulled by a sinner who sets village or forest ablaze.

જે ગામ તથા વનને બાળે છે તેમને યમદૂતો પોતે ગાડામાં બેસી તેમની પાસે ગાડું ખેંચાવી યમપુરીમાં આનંદથી ફરે છે.



One who breaks others' teeth is thrown into a deep reservoir and Yamadutas break one's teeth cruelly.

જવને પકડી દાંત તોડનારના દાંત તોડી ઊડા કુંડમાં નાખે છે.



Taptasurmi Hell: A man or a woman who commits adultery is made to embrace repeatedly a red-hot iron-pole by Yamadutas. This hell is known as Taptasurmi Hell.

અગમાગમન કરનાર નર કે નારીને યમદૂતો તપાવેલા લોઢાના થાંભલાઓ ઉપર વારંવાર ચઢાવે છે. આ નરકને તપ્તસૂર્મિ નરક કહે છે.



Vajrakantaka Hell: He, who joins in sexual intercourse with beasts, is dragged to Vajrakantaka Hell where his body is pierced with the thorns of Shalmali tree. One joining in sexual intercourse with one and all undergoes such miserable state.

પશુઓ સાથે સંભોગ કરનાર જીવને વજ્રકંટક નરકમાં નાખવામાં આવે છે. અહીં શાલ્મલિના કાંટા તેના અંગમાં પેસી જાય છે. સર્વ અભિગમન કરનારની આવી ગતિ થાય છે.



One, who jumbles the duties imposed on people of four classes, is forced to drink boiling mixture of five metals.

ચારે વર્ણના ધર્મનો એકાકાર કરી જે વર્ણસંકરતા ઊભી કરે છે તેને મર્યા પછી ચમદૂતો પંચધાતુનો ગરમ રસ પાય છે.



Tamistra Hell: He who steals is caught with iron noose and hung with his head downward in Tamistra Hell wherein there is extreme darkness, serpents, crows, etc. prickles his body. Other Jivas are kept ready to be punished.

પતિને ઠગીને તેની સ્ત્રી સાથે વ્યભિચાર કરનાર તથા ચોરી કરનાર જીવને લોહપાશથી પકડી તામિસ્ત્ર નામના અંધકારમય નરકમાં ઊંધે માથે લટકાવવામાં આવે છે. અહીં સાપ, કાગડા વગેરે તેને બટકા ભરે છે. બીજા જીવોને પણ સજા કરવા પકડી રાખ્યા છે.



Avichiman Hell: He who gives false evidence or tell lies in exchange of money or does not give the donation declared by him or who devotes God fraudulently is assigned to Avichiman Hell wherein he gets rigorous oppression by being repeatedly thrown down the top of a mountain.

દ્રવ્યની લેણદેણમાં ખોટી સાક્ષી પૂરનાર, ખોટું દાન બોલનાર તેમજ દંભથી રામનું નામ લેનાર જીવોને યમદૂત અવિચિમાન નરકના પહાડની ટોચેથી વારંવાર ફેંકી બહુ દુઃખ આપે છે.



He, who eats creatures baking them alive or injures them, is severely beaten by Yamadutas and they delight his meat after baking him on a huge burning fireplace in Kumbhipak Hell and they penetrate his body with pointed weapons of iron. Crows, serpents bite him and he cries loudly.

જે જીવ જીવતા જીવને શેકીને ખાય છે અને હિંસા કરે છે તે જીવ નરકકુંડમાં જાય છે અને ત્યાં યમના ધોકા ખાય છે અને યમ તેને શેકીને ખાય છે તથા લોઢાના અંકુશ લઈ શરીરમાં ખોસી બહુ ત્રાસ આપે છે. કાગડા, સાપ કરડે છે તેથી જીવ અતિશય પોકાર કરે છે.



If a woman transgresses vow of chastity or does not obey the menstruation duties, such a woman is beaten by Yamadutas for as many years as there are hairs on her body. Yamadutas take her into Kumbhipak Hell and lancinate her body with pointed weapons. She is also thrown into a waterless jungle wherein she is bitten by she-demons, crows, serpents, scorpions, etc.

જે સ્ત્રી નિષ્કામ વ્રતનો ભંગ કરે છે અને કરાવે છે તથા રજસ્વલા ધર્મ પાળતી નથી, તે તેના તનમાં જેટલા રોમ હોય તેટલા વર્ષપર્યન્ત યમનો માર ખાય છે. યમદૂતો અંકુશો વડે તેનાં અંગ ચીરે છે અને તેને નિર્જળ વનમાં બાળે છે.



Lord Shri Swaminarayan was in Gadhapur where lived Hema Sheth. Yamadutas came to take away Hema Sheth. He recalled all other Gods but in vain. Then he recalled Shriji Maharaj who Himself arrived and drove away Yamadutas and redeemed Hema Sheth.

દરદી સંભારે જો દરદમાં, તેની શ્રી હરિ કરે સહાય -- ગઢપુરના જૈન હેમાશેઠ યમદૂતોથી બચવા ઘણાં દેવ-દેવીઓને સંભારી ચૂક્યા. છેવટે શ્રીજી મહારાજ યમદૂતોથી તેમની રક્ષા કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું શરણ કાળના ભયથી મુક્ત કરે છે.